

B.Com. Semester - 5 (CBCS) Examination
Oct/Nov - 2024 (NEW COURSE)
Indirect Tax Law - 1(Dse-3)

Time: 2:30 Hours

Marks: 70

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

- પ્રશ્ન. ૧ GST નો ખ્યાલ અને તેના ફાયદા વર્ણવો. (20)
 અથવા
- પ્રશ્ન. ૧ ભારતમાં GST ની જરૂરીયાતોની ચર્ચા કરો.
- પ્રશ્ન. ૨ અવેજ સહિતના પુરવઠા પર વિસ્તાર નોંધ લખો. (20)
 અથવા
- પ્રશ્ન. ૨ સંયુક્ત પુરવઠો અને મિશ્ર પુરવઠો નોંધ લખો.
- પ્રશ્ન. ૩ રિવર્સ ચાર્જ અન્વયે વસ્તુના સમયનો પુરવઠો સમજાવો. (15)
 અથવા
- પ્રશ્ન. ૩ ફોરવર્ડ ચાર્જ અન્વયે સેવાના સમયનો પુરવઠો સમજાવો.
- પ્રશ્ન. ૪ કિંમત પુરવઠા અન્વયે નીચેના પર નોંધ લખો. (ગમે તે બે) (15)
 (A) એજન્ટ
 (B) વ્યવહાર મુલ્ય
 (C) નાણું
 (D) વ્યક્તિ

ENGLISH VERSION

- Que.1 Describe the concept of GST and its Advantages. (20)
 OR
- Que.1 Discuss the requirements of GST in India.
- Que.2 Write area notes on supplies with consideration. (20)
 OR
- Que.2 Write a note on composite supply and mixed supply.
- Que.3 Explain time of supply of Goods under reverse charge. (15)
 OR
- Que.3 Explain time of supply of service under forward charge.
- Que.4 Write a note under value of supply. (Any Two) (15)
 (A) Agent
 (B) Transaction value
 (C) Money
 (D) Persons
